



Date: 27-05-2025

BSE Limited

Dept. of Corporate Services, Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 400 001 BSE Scrip Code - 541304 **National Stock Exchange of India Limited**

Dept. of Corporate Compliances, Exchange Plaza, C-1 Block-G, Bandra Kurla Complex, Bandra (E) Mumbai- 400 051

NSE Symbol: INDOUS

Subject: Newspaper Advertisement relating to Audited Quarterly Standalone Financial Results for the Year or quarter ended on 31st March, 2025.

Dear Sir,

With reference to the subject mentioned above we are submitting the Newspaper Advertisement relating to Audited Quarterly Standalone Financial Results for the year or quarter ended on 31st March, 2025 published in Western times - English and Western times - Gujarati Newspaper to comply Regulation 47 of SEBI LODR Regulations.

Kindly take it in your record.

Thanking you,

Yours faithfully,

For, Indo Us Bio Tech Limited

DIMPY
DIVYANGBHA JOSHI

Digitally signed by DIMPY DIVYANGBHAI JOSHI

LJOSHI

Date: 2025.05.27 10:37:12 +05'30'

Ms. Dimpy Joshi

Company Secretary & Compliance Officer



Blue Water Logistics IPO Opens today: Company Aims to Raise Rs.40.50 Crores on NSE Emerge

Logistics Limited has announced its plans to go public with an Initial Public Offering (IPO) set to open on Tuesday, May 27, 2025, running through Thursday, May 29, 2025. The logistics company aims to raise up to Rs.40.50 crores through the offering, with shares scheduled to be listed on NSE Emerge, the SME platform of the National

Stock Exchange. The public issue comprises 30,00,000 equity shares with a face value of Rs.10 each, priced within a band of Rs.132 to Rs.135 per share. The offering is structured as a 100% book-built issue with a minimum lot size of 1,000 shares, making the minimum investment requirement between Rs.1,32,000

Mumbai, Blue Water Rs.1,35,000 for retail in-

vestors.
The company's shareholding will expand from the current 80,00,000 shares to 1,10,00,000 shares post-issue, with the entire offering consisting of fresh shares and no offer for sale component.

Listing and Timeline Blue Water Logistics shares are tentatively scheduled to debut on NSE Emerge on Tuesday, June 3, 2025. The three-day subscription window provides investors with ample opportunity to participate in the offering. Shreni Shares Limited has been appointed as the market maker with an al-

The company has outlined a clear roadmap for utilizing the net proceeds from the fresh issue. The

location of 1,56,000

primary objectives include funding capital expenditure requirements through the purchase of vehicles and body building, addressing working capital needs, and supporting general corporate purposes. This strategic allocation reflects the company's focus on expanding its logistics capabilities and

operational infrastructure.

Mr. Laxmi Narayan

Mishra, Chairman & Whole-Time Director of Blue Water Logistics, expressed enthusiasm about the public offering. "We see this as an opportunity to not only grow the company but also contribute to a more sustainable future. We are excited about this new phase of development and are grateful to NSE to offer us NSE Emerge platform to list our Company," he stated.

no traces of hacking ac-

tivity have yet been found

on the servers of KT or

LG Uplus, they added.

reports Yonhap news

agency. In a media brief-

ing last week, the investi-gation team revealed in-

terim findings indicating

that 25 malware variants

had been discovered on

23 servers belonging to

SK Telecom. These in-

cluded 24 variants of the

BPFDoor malware and

one variant of WebCell.

Two of the affected serv-

ers had been used as

temporary storage for

personal data, such as

names, birthdates, phone

numbers and email ad-

dresses, as well as inter-

national mobile equip-

ment identity (IMEI) data.

Major S. Korean firms spend annual average of \$2.1 million on cybersecurity

Seoul, May 26 (IANS) South Korea's major companies spent an average of 2.9 billion won (\$2.1 million) per year on information protection, industry data showed on Monday.

According to data from the Korea Internet & amp; Security Agency (KISA) and other sources, 10 local companies each invested ever 100 killion vested over 100 billion won in cybersecurity over the past three years.

Samsung Électronics Co. topped the list, spending a total of 712.6 billion won from 2021-2023, followed by telecom giant KT Corp., which invested 327.4 billion won during the same period, reports Yonhap news agency.

SK Telecom Co., the country's largest mobile carrier that recently suffered a large-scale data breach, came in third with 251.5 billion won in spend-

Other companies in the top 10 include Coupang Inc., SK hynix Inc., LG Up-lus Corp., Samsung SDS Co., Woori Bank, Naver Corp. and LG Electronics

In 2022, the South Korean government mandated that companies operating network infrastructure or generating over 300 billion won in annual sales disclose their cybersecurity investment. 'Many are more vul-

nerable to advanced hacking techniques, and some may have already been breached without even knowing it.A total of 746 companies reported their spending on information protection for 2023, investing a combined 2.1 trillion won, up from 1.5 trillion won by 658 firms in 2021.

The average annual spending per company increased 24.5 percent from 2.3 billion won in 2021 to 2.9 billion won in 2023.

However, experts warn that many South Korean firms remain highly vulnerable to cyberattacks due to relatively weak security capabilities, said the re-

port.
"In terms of investment, most companies in Korea have far lower security capabilities than SK Telecom, which was the latest victim of a cyberattack," one industry insider said. "Many are more vulerable to advanced hacking techniques, and some may have already been breached without even knowing it. Companies need to stay alert and undergo thorough security checks," the insider added.—IANS

nalizing next-generation in-

novations. Since launching

the ZER01NE platform in

2018, the group has estab-

lished two previous funds. Together, those funds have

backed 105 startups and

generated more than 200

collaboration cases across the group. "By deepening

collaboration with innova-

tive startups, we aim to

generate meaningful syn-

ergies across our affiliates

and accelerate our future-

ready business initiatives,

said Noh Kyu-seung, head

Business Brief |||

Zepto CEO accuses rival company's CFO of targeting them with a smear campaign

New Delhi, May 26 (IANS) Aadit Palicha, the CEO and Co-founder of quick delivery platform Zepto, has alleged that the chief financial officer (CFO) of a rival company is running a smear campaign against them over the past few days.

In a LinkedIn post, Palicha said the spam campaign includes "salling our investors to peak a wild-

paign includes "calling our investors to make wild allegations about us with no empirical evidence, giving out false numbers/Excel sheets on Zepto through sources known to journalists, and paying bots on social media to spread a negative narrative"

He, however, did not reveal the name of the rival firm. In the quick commerce space, Zepto competes with Blinkit (owned by Eternal which was earlier Zomato), Swiggy Instamart, Flipkart Minutes and Tata BigBasket, among others. "Candidly, this episode is below the stature expected of the CFO of a high-quality company, and makes it obvious that they are starting to get nervous about how fast Zepto's EBITDA is improving," said Palicha. He further stated that Zepto has grown from approximately 750 crore of gross order value (GOV) per month in May 2025 "Quir definition of GOV has Fruits and Vegeta 2025. "Our definition of GOV has Fruits and Vegetables at selling price and includes Ad Revenue. Our EBITDA has improved by 20 absolute percentage points (2,000 basis points) from January 2025 to May 2025, and is approaching single-digit territory.

Bumper RBI dividend to give extra 0.15 pc fiscal boost to GDP: Report

New Delhi, May 26 (IANS) The incremental gain from the higher RBI dividend is expected to partly offset potential shortfalls in tax revenues and nominal GDP growth, a report said on Monday, adding that supported by a robust RBI dividend, system liquidity is likely to improve further.

This marks the third consecutive year where the actual dividend has exceeded the initial budgeted number. This implies an extra fiscal boost of 0.15 per cent of GDP. Accordingly, "we maintain our FY26 gross FD/GDP target at 4.4 per cent, in line with the budget estimate," according to the report by Emkay Global Financial Services. "We expect Q1 FY26E to be in super surplus liuidity (with June tracking Rs 4-4.5 trillion), led by high RBI dividend of Rs 2.68 trillion and a sharp seasonal moderation in currency in circulation (CIC), aong with RBI OMOs," the report added. The RBI has announced a record dividend of Rs 2.68 trillion to the Centre for FY25, which is around 28 per cent higher than the Rs 2.1 trillion assumed in the FY26 Union Budget. While the annual report is yet to be released, which will provide detailed insights into the balance sheet, "we understand the bumper dividend is likely driven by higher gross FX sales of \$398 billion in FY25 compared to \$153 billion last year, which boosted foreign exchange income, increased interest income from Gsecs, and lower provisioning for revaluation losses on assets, amid possible MTM (mark-to-market) gains on both foreign and domestic asset holdings,

Probe into SK Telecom data breach expands to KT, LG Uplus

local telecommunications

and platform companies to

conduct their own cyberse-

curity inspections. Howev-

er, the approach was re-

Seoul, May 26 (IANS) A joint government-private investigation team looking into SK Telecom Co.'s recent large-scale data breach has extended its probe to the servers of two other major mobile carriers, KT Corp and LG Uplus, but found no signs they have been compromised, industry sources said on Monday. Initially, the team had asked

E AUCTION NOTICE APPROX 3,72,200 KG OF WATER AFFECTED VARIOUS TYPES OF ONION & GARLIC

nterested Buyers are invited to participate in the e-Auction for the disposal of "Approx 3.72.200 Kg of Water Affected Various types of Onion & Garlic" on "Per Kg" Basis. The subject salvage will be sold on "As is Where is". Whatever there is" and "No Complaint Basis and belongs to M/s. Real Dehydrates & M/s. Real Foods And Spices. The subject materials can be inspected at Survey No 143 P5, and Survey No. 143 P5 P1 - Bhanvad Road, Bhanvad Village, Mahuva, Gujara 364290 on working days only betweer **26-05-25 to 29-05-25.** Kindly contact Mr. Pradeep Bhojani at 8347077356 (M/s. Real Dehydrates) or Mr. Bharatbha Bambhaniya # 9904592686 (M/s. Real Foods and Spices) for inspection

E-Auction will be held on 30-05-25. Kindly contact Mr. Atul Halarnkar at 7738164069 to obtain the form containing terms & conditions of

e-Auction or download from website

https://www.sealthedeal.co.in/ Auctioneers: Seal The Deal having registered office at Shop No. 148 Pocket C2, Sector 5,

Rohini, Delhi - 110085 ast date of Submission of form 8 EMD Demand Draft is 29-05-25.

E-AUCTION NOTICE FIRE AFFECTED WASTEPAPER ND SPOILT WOOD POWDER

nterested Buyers are invited to participate in the e-Auction for the disposal of "Fire Affected Wastepaper and Spoilt Wood Powder" on "Lump Sum" Basis. The subject salvage will be sold on "As is Where is" "Whatever There Is" and "No Complaint" Basis and belongs to M/s. Lemit Papers LLP The subject materials can be inspected at Casva Tiles Pvt Ltd - Survey No. 1273, Khakhrichi, Maliya Ahmedabad Highway Morbi Guiarat -363630 between 27-05-25 to 04-06-25 between 10 AM to 5 PM on working days only. Kindly contact Mr. Parth Kaila at 9638194000 or Mr. Nikunj Detroja # 9638144000 for inspection.

E-AUCTION WILL BE HELD ON 05-06-25 Kindly contact Mr Nitin Kumar at

7011830975 to obtain the form containing terms & conditions of e-Auction or download from website https://www.sealthedeal.co.in/.

Auctioneers: Seal The Deal having registered office at 148, Pocket C2. Sector 5. Rohini. Delhi - 110085.

PARTICULARS

Profit/(Loss) before exceptional items and tax

Exceptional items- Prior Period Items

Net Profit/(Loss) for the period/year

Total income from operations

Profit/(Loss) before tax

Total tax expenses

-Basic

LAST DATE OF SUBMISSION OF FORM & EMD DEMAND DRAFT IS 04-06-25

vised last week amid growing concerns that hackers using BPFDoor malware variants may have also targeted other South Korean mobile carriers, according to the sources. Following

the expanded investigation,

have changed my old name from NISHA KANAIYALAL KUNDLANI to new name **BHAVIKA MANISHKUMAR CHAWLA**

CHANGE OF NAME

Add. A/104, Karnavati Klassic Residency, B/h. Hotel Gate Way, Hansol Ahmedabad

PUBLIC NOTICE

759

It is hereby informed to public at large that, Property bearing Mouje: Berna Block/Survey No. 322 Paiki 1 Paiki, House Constructed in Plot No. 8, situated at Berna, within the limits of Berna Gram Panchavat, At & Po: Berna, Ta: Himatnagar Dist.: Sabarkantha, (Land Area Admeasuring 124.875 Sq. Mtrs. (Construction area of 66.50 Sq. Mtrs. and 58.375 Sq. Mtrs. Margin)), is owned and possessed by Mrs. Geetaben Dipakkumar Raval & Mr. Piyushkumar Kantibhai Prajapati, and demanded title clear certificate from me, in that regards, previously, the said Property, i.e., Property bearing Mouje: Berna, Block/Survey No. 322 Paiki 1 Paiki, House Constructed in Plot No. 8, situated at Berna, within the limits of Berna Gram Panchayat, At & Po: Berna, Ta: Himatnagar, Dist.: Sabarkantha, (Area Admeasuring 124.875 Sq. Mtrs. (Construction area of 66.50 Sq. Mtrs. and 58.375 Sq. Mtrs Margin)), purchased by Maganbhai Dahyabhai Patel, vide Registered Sale Deed No 4667/2011, dated: 27/05/2011, from Dhaniibhai Ramiibhai Patel & Bahechar bhai Ramjibhai Patel, is not found. In respect of above property ownership, of against property or against land, if any person/ institution has any right title or interest of the said property is taken under attachment or if any objection if prevailed upon then inform with supporting documents within 7 (Seven) Days of period through R. P. A. D. to me and in failure of which nobody has any kind of Right Title or interest of borrowing or share etc. Then to initiate further process accordingly and ere after no any kind of objection shall be enter signed which be noted

Place: Himatnagar Date: 27-05-2025

Nishant M. Soni (Advocate) Add: Office No.FF-129, 1st Floor, Sun Complex, Motipura, Himatnagar, Dist. S.K.(Guj.) 7405629009

dholera

-A NEW ERA-

Dholera Special Investment Regional Development Authority

Application are invited for the following posts

Sr. No.	Name of post	Vacancy
1	Junior Town Planner	3
2	Planning Assistant	3
3	Office Superintendent	2

The above-mentioned Positions will be filled through outsourcing basis Eligible and interested candidates can apply by visiting our website www.dholera.gujarat.gov.in/dsirda/jobs, where all details regarding educational qualifications, experience, criteria, age limit, and other rules and conditions for the above positions, Applications should be submitted in person/by RPAD/Courier at the office address given below during office hours on or before june 10, 2025.

Address: Dholera Special Investment Regional Development Authority Block No: 11/12, 3rd Floor Udyog Bhavan, Sector 11 Gandhinagar, 382010 INF/435/2025-26

INDO US BIO-TECH LIMITED (CIN: L01122GJ2004PLC043550) Regd. Office: 309, Shanti Mall, Satadhar Cross Road, Sola Road, Ahmedabad-380 061, (Gujarat) India Website: www.indousagriseeds.com E-Mail ID: indouscs@gmail.com Extract of Statement of Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2025

Hyundai Motor Group launches \$91.4 million startup investment fund lion won, while Hyundai iates, with a focus on inter-

Motor Securities Co. con-

tributed 10 billion won. Ad-

ditional investments came

from seven other units, in-

cluding Hyundai Mobis
Co., Hyundai Glovis Co.
and Hyundai Rotem Co.

The fund aims to identify

and invest in promising

startups in South Korea,

Japan and Southeast Asia,

particularly those working

in the fields of artificial in-

telligence, robotics, hydro-

gen and cybersecurity. The

group said it will also seek

strategic collaboration op-

portunities between the se-

lected startups and its affil-

Seoul, May 26 (IANS) Hyundai Motor Group said on Monday it has estab-lished its third startup investment fund to support innovative venture companies with cutting-edge technologies and ideas. The group's third fund under its ZER01NE accelerator program has been set up at a scale of 125 billion won (US\$91.4 million), with financial participation from group affiliates, reports Yonhap news agency. Hyundai Motor Co. and Kia Corp. each invested 40 bil-

CHANGE OF NAME

I have changed my old name from RAJESHRIBEN SURENDRAKUMAR SHAH to new name RAJESHREE **SURENDRA SHAH** Add. 303 A, Vasupujya

Appartments Naranpura, Ahmedabad

CHANGE OF NAME

I have changed my old name from **MODI MITESHKUMAR** BHARATBHAI to new name MODI MITESHKUMAR **BHARATKUMAR** Add. 234, Anandnagar

Society, Sector-27. Gandhinagar-382028

CHANGE OF NAME have changed my old name from **NISHIL NITINBHAI NISHIL NITIN PANDYA** Add. 12-A Paras Bunglows-

CHANGE OF NAME

Satellite. Ahmedabad

from MODI CHINTAL $\mbox{\bf MITESHKUMAR}$ to new name MODI CHINTALBEN MITESHKUMAR Add. 234, Anandnagar Society, Sector-27,

PUBLIC NOTICE FORM NO. URC

Advertisement giving notice about registration under Part I of Chapter XXI [Pursuant to section 374(b) of the Companies Act, 2013 and rule 4(1) of the companies (Authorised to Register) Rules, 2014]

- . Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act. 2013, an application has been made after fifteen days hereof but before the expiry of thirty days hereinafter to the Registrar at Gujarat, Dadra & Nagar Haveli, that DIGIMORE LLP a LLP may be registered under Part Lof Chapter XXI of the Companies Act 2013, as a company limited by shares.
- The principal objects of the proposed company are as follows: -Manufacture and trading of other electrical equipment that includes microphones, including condenser, dynamic, ribbon, and USB microphones, as well as wireless systems, boom arms, and
- A copy of the draft memorandum and articles of association of the proposed Company may be inspected at the office at B 102, First Floor, Abhishek Complex, Asarva, Ahmedabad, Gujarat, India,
- . Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6,7,8, Sector 5, IMT Manesar, District Gurgaon (Haryana), Pin Code-122050, within 21 (Twenty One) clear days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Year ended

31-03-2025

(Audited)

10,402.040

1,653.060

1.653.060

31-03-2024

(Audited)

1,597.710

62.930

62.930

Dated this 27 day of May, 2025. Place: Ahmedabad

FOR DIGIMORE LLP

RAJESH NENWANI DESIGNATED PARTNER DPIN:08889983

(Amounts in Lakhs)

Year ended

31-03-2024

(Audited)

879.350

879.350

Mr. Jagdish Ajudia

(Managing Director)

7,315.480

of the ZERÓ1NE division at Hyundai Motor Group. Meanwhile, Hyundai Mobis has filed more than

7,500 patents over the past three years to strengthen its global competitiveness through proprietary technologies in future mobility and electrification, according to the company on Monday.

he report explained.

SUVIDHA INFRAESTATE CORPORATION LIMITED

[CIN: L70102GJ1992PLC016978] Registered Office: A-305,306 Krishna complex, Opp. Devashish School, Bodakdev, Ahmedabad - 380 054

> AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE FINANCIAL YEAR ENDED ON 31ST MARCH, 2025

The Board of Directors in their meeting held on 26th May, 2025, have approved and taken on

record the Audited Financial Results for the Quarter and year ended on 31st March, 2025 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The aforesaid Audited Financial Results for the year ended 31st March, 2025along with Auditors Report thereon are available on website of BSE Limited at www.bseindia.com and also on

Company website and can also be accessed by scanning below Quick Response Code: In case there are any question on the above disclosure, please reach out to us at info@suvidhaprojects.com Tel: 079-26872946



Date : 26h May, 2025 Place : Ahmedabad

Corporation Limited KISHORE K. GOSWAMI MANAGING DIRECTOR (DIN: 00289644)

For Suvidha Infraestate

By Order of the Board

PUBLIC NOTICE Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007 Corporate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex Mumbai 400051 GOLD E-AUCTION CUM INVITATION NOTICE

The below mentioned borrowers have been issued notice to pay off their outstanding amount towards the facility against gold ornaments. ("Facility") availed by them from ICICI Bank Limited ("ICICI Bank"). We are constrained to conduct an E-Auction of pledged gold ornaments on June 06, 2025 as they have failed to repay the dues. ICICI Bank has the authority to remove account /change the E-Auction date without any prior notice. Auction will be held online-https://jewel-auction.procuretiger.com/between 12:30 pm to 3:30 pm. For detailed Terms and conditions, please log into given website. In

ise of deceased b			will be applicable to legal heirs.	onditions, please log i
Logn A/C No	Customer Name	i i	Loan A/C No. Customer Name	Logn A/C No
Branch Name	: Abmodabad		Loan A/C No.	Loan A/C No. Branch Name: R
Kho	: Ahmedabad - okhra		Jayeshkumar	183562002118
50762000585	Pavansingh		Hasmukhbhai	103302002110
	Mohansingh		Branch Name: Dharmaj	Branch Na
	Rajput		137262002509 Kartikkumar Patel	137762005365
Branch Name	: Ahmedabad-		Branch Name: Dholka	
8apt 19306200393	inagar Abhishek		182962010490 Ghanshyambhai	Branch Nar
93062003931	Hasmukhbhai		Dipubhai Patel	183462007803
	Devani		Branch Name: Goradka	
Branch Name	e: Ahmedabad-		307862001164 Meyada	183462008353
Gand	hiroad		Vipulbhai	
136905001017	Vandanaben		Arjanbhai	Branch N
	Shaileshkumar Halani		Branch Name: Halvad 171162005820 Dilipbhai	170562013458
Down of No	ame: Anand		171162005820 Dilipbhai Deykaranbhai	
25662004325	Rushitaben		Bhoraniya	
25002004325	Jigneshkumar		171162011064 Vijaykumar	Branch Name
	Prajapati		Rajeshbhai	183962001651
25662004756	Rushitaben		Patadiya	
	Jigneshkumar		Branch Name: Halvad - Apmc	Branch Name: S
	Prajapati		326562001398 Jashiben Karamshibhai	005262012758
Branch Name: A	nkleshwar - Gidc Pushpanatha		Bharvad	000202012700
76662000378	Pushpanatha Shetty		Branch Name: Jamnagar	Branch No
Branch No	ime: Bardoli		020562013842 layshukh	Minibazao
45962009169	Bhavishaben		Govindbhai	183862004839
745962009169	Dharmeshkumar		Karngiya	
	Patel		Branch Name: Jamnagar - Green	
45962009331	Bhavishaben		City 467562000090 Minaxiben Jani	Branch Name
	Dharmeshkumar	Ш	Branch Name: Jasdan	138662002072
	Patel		170862014400 Jagadish	
45962009929	Mehul		Devashibhai	Branch Name
	Bharatbhai Jadav		Bavaliya	138562005202
45962009933	Mohammadsakil Alikhan Pathan		Branch Name: Kalawad	IOOOOLOOLOL
Demands No.	me: Bhachau		791362000115 Gamara	
			Maiyabhai	Branch No
	Sadananda Jena		Branch Name: Kalol	375762004459
Branch Name	e: Bhavnagar - nd Bazar		200662001398 Alpeshkumar	
164762000153	Sudershankumar		Patel	Branch No
.04,02000133	Mundrikprasad		Branch Name: Karjan 213162009206 Rajubhai	215762008257
	Yadav		Bharvad	
Branch No	ime: Borsad		Branch Name: Khambhalia	Branch Name
84662009554	Jayeshbhai		170462014519 Hardasbhai	363462002846
	Jayantibhai Patel		Mesurbhai	363462003028
Branch N	ame: Botad		Chavada	363462003028
L37562044655	Khachar		Branch Name: Khambhat	363462008335
	Pratapbhai Apabhai		183262014296 Rathod Rajubhai	
Branch Name:	Chhota Udaipur		Branch Name: Kheda	363462008620
280962001405	lipwala Mustafa		202062004765 Kishan Vikrambhai	
280962001408	Jinwala Mustafa Jinwala Mustafa		Thakor	Branch Nan
Branch No	me: Chikhli		Branch Name: Kheralu	170662023528
281062002837	Vimalkumar		400662003614 Daliibhai	
	Harilal Patel		Mansungbhai	
Branch No			Chaudhary	170662018274
184062010140	ıme: Dabhoi Bariya		Branch Name: Kosamba	170662018274
	ime: Dabhoi Bariya Tineshbhai		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh	
184062010140	ime: Dabhoi Bariya Tineshbhai Bariya		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh Branch Name: Lunawada	170662017888
184062010062	ame: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh Branch Name: Lunawada 780262000545 Machhar	170662017888
184062010062 Branch Nar	ame: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai me: Dadheda		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh Branch Name: Lunawada 780262000545 Machhar Bharatbhai	170662017888 170662022386
184062010062	me: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai me: Dadheda Akshaybhai		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh Branch Name: Lunawada 780262000545 Machhar Bharatbhai Branch Name: Mansa - Muktanand Complex	170662017888 170662022386 170662022458
Branch Nar 757362000556	ame: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai ne: Dadheda Akshaybhai Vasava		Branch Name: Kosamba	170662017888 170662022386
Branch Name: Branch Name:	ame: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai me: Dadheda Akshaybhai Vasava Dahod-Gujarat		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh Branch Name: Lunawada 780262006345 Machhar Bharatbhai Branch Name: Mansa Muktanana C 172062009149 Prakashpuri Baya	170662017888 170662022386 170662022458
Branch Nar 757362000556	ame: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai ne: Dadheda Akshaybhai Vasava		Branch Name: Kosamba	170662017888 170662022386 170662022458 170662021145
Branch Name: Branch Name:	ime: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai ne: Dadheda Akshaybhai Vasava Dahod-Gujarat Shahrukh		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh	170662017888 170662022386 170662022458
Branch Name: Branch Name:	ime: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai ne: Dadheda Akshaybhai Vasava Dahod-Gujarat Shahrukh Hamidbhai Munda		Branch Name: Kosamba 138462008708 Muskan Sholikh Branch Name: Lunawada 780262009545 Machhari Branch Name: Researate Complex 172062009149 Prakashpuri Branch Name: Mata Borsara 759062001557 Mathamar	170662017888 170662022386 170662022458 170662021145 Branch No
B4062010062 Branch Nar 757362000556 Branch Name: 046662013840	ime: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai me: Dadheda Akshaybhai Vasava Dahod-Gujarat Shahrukh Hamidbhai Munda Mohammadarsh Salimbhai Mevati		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh Branch Name: Lunawada 780262000548 Machhar Bharatbhai Branch Name: Mansa - Muktanand Complex 172062009149 Prakashpuri Branch Name: Mote Borsara 759062001557 Chetanprakash Vimalkumar Navlakha	170662017888 170662022386 170662022458 170662021145 Branch N. 399662002406 Branch Nan
Branch Nar 57362000556 Branch Name: 946662012260	me: Dabhai Bariya Tineshbhai Bariya Tineshbhai me: Dadheda Akshaybhai Vasava Dahad-Gujarat Shahrukh Hamidbhai Mohammadarsh Salimbhai Mevati		Branch Name: Kosamba 138462008708 Muskan Shoikh Branch Name: Lunawada 780262009545 Machhar Branch Name: Muskandand Complex 172062009149 Prakashpuri Branch Name: Mota Borsara 759062001557 Chetanprakash Navilakha Branch Name: Name	170662017888 170662022386 170662022458 170662021145 Branch N. 399662002406
B4062010062 Branch Nar 757362000556 Branch Name: 046662013840	ime: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai ne: Dadeden Angariya Angariya Dahad-Sujarat Shahrukh Hamidbhai Munda Mohammadarsh Salimbhay Ravindrakumar		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh Branch Name: Lunawada 780262000548 Machhar Bharatbhai Branch Name: Mansa - Muktanand Complex 172062009149 Prakashpuri Branch Name: Mote Borsara 759062001557 Chetanprakash Vimalkumar Navlakha	170662017888 170662022386 170662022458 170662021145 Branch N. 399662002406 Branch Nan
Branch Nar (57362000556 Branch Name: 046662012260 046662013840	me: Dabhai Bariya Tineshbhai Tineshbhai Tineshbhai Tineshbhai Tineshbhai Tineshbhai Tineshbhai Tineshbhai Tineshbhai Akshaybhai Vasava Dahad-Sujarat Shahrukh Hahai Hahai Mohammadarsh Salimbhai Mevati Alay Ray Ray Sheth		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nam 139762007621
B4062010062 Branch Nar 757362000556 Branch Name: 046662013840	ime: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai ne: Dadheda Akshaybhai Dehod-Gujarat Shahrukh Hamidbhai Munda Mohammadarsh Salimbhai Mevati Ashaybunar Sheth Vijjaybhai		Branch Name: Kosamba 138462008708 Muskan Shaikh	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nam 139762007621
Branch Name: Branch Name: Branch Name: Branch Name: 046662013840 046662013973	me: Dabhai Bariya Tineshbhai Bariya B		Branch Name: Kosamba 138462008708 Muskan Sholikh Branch Name: Lunawada 780262000545 Machhar Branch Name: Lunawada Mukanand Complex 172062009149 Prakashpuri Branch Name: Mota Borsara 759062001557 Chetanprakash Naviakha Branch Name: Neilaabdasa 170162007185 Mustak labal 170162007186 Bhatti 170162007186 Bhatti Branch Name: Nesda Nava	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nam 139762007621
Branch Name: 157362000556 Branch Name: 146662012260 146662013840 146662013973 163962002585	me: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai ne: Dadheda Akshaybhai Dahod-Gujarat Shabrukh Hamidbhai Munda Mohammadarsh Salimbhai Mevati Agrayahai Rayumar Sheth Vijaybhai Chimanbhai Bhoi ame: Deesa		Branch Name: Kosamba	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nom 139762007621 Branch No. 042962005875
Branch Nar 57362000556 Branch Name: 46662012260 46662013840 46662013973 463962002585 Branch No	ime: Dabhai Bariya Tineshbhai Bariya Tineshbhai ne: Dadheda Akshaybhai Daheda Akshaybhai Daheda Akshaybhai Munda Mohammadarsh Salimbhai Mevati Alay Ravindrau Lhimanbhai Bhoi ame: Deesa Mahandrakumar Ghoghol		Branch Name: Kosamba 138462008708 Muskan Sholikh Branch Name: Lunawada 780262000545 Machhar Branch Name: Lunawada Mukanand Complex 172062009149 Prakashpuri Branch Name: Mota Borsara 759062001557 Chetanprakash Naviakha Branch Name: Neilaabdasa 170162007185 Mustak labal 170162007186 Bhatti 170162007186 Bhatti Branch Name: Nesda Nava	170662017888 170662022386 170662022458 170662021145 Branch Nam 139762007621 Branch Nem 042962005875 Branch Name:
Branch Name: 157362000556 Branch Name: 146662012260 146662013840 146662013973 163962002585	me: Dabhai Bariya Tineshbhai Bariya Bariya Bariya Bariya Bariya Bariya Bariya Bariya Alai Alai Bariya Bariy		Branch Name: Kosamba	170662017888 170662022386 170662022458 170662021145 Branch Nam 139762007621 Branch Nem 042962005875 Branch Name:
Branch Name: 57362000556 Branch Name: 146662013260 146662013840 146662013973 183962002585 Branch N. 149762013493	me: Dabhoi Bariya Tineshbhoi Beriya Tineshbhoi Beriya Tineshbhoi Beriya Tineshbhoi Tines		Branch Name: Kosamba 138462008708 Muskan Sholikh	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nom 139762007621 Branch No. 042962005875 Branch Name: Alki, 436562000300
Branch Nar 57362000556 Branch Name: 46662012260 46662013840 46662013973 463962002585 Branch No	me: Dabhoi Bariya Tineshbhai Bariya Tineshbhai ne: Dadheda Asia Asia Asia Asia Asia Asia Asia Asi		Branch Name: Kosamba	170662017888 170662022386 170662022458 170662021145 Branch Na 399662002406 Branch Nam 139762007621 Branch Name: \ 042962005875 Branch Name: \ Alk 436562000300 Branch Name: \ Alk 436562000300
Branch Name: 57362000556 Branch Name: 146662013260 146662013840 146662013973 183962002585 Branch N. 149762013493	me: Dabhoi Bariya Tineshbhoi Bariya Tineshbhoi Bariya Bariya Bariya Tineshbhoi Bariya		Branch Name: Kosamba 138462003708 Muskan Sholikh	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nom 139762007621 Branch No. 042962005875 Branch Name: Alki, 436562000300
Branch Name: 57362000556 Branch Name: 046662012260 046662013840 046662013973 363962002585 Branch No. 049762019493	me: Dabhoi Bariya Tineshbhai Tineshbhai Tineshbhai me: Dadheda Akshaybhai Vasava Dahad-Sujarat Shahrukh Munda Mohammadarsh Salimbhai Mevati Vijaybhai Vijaybhai Tineshbai Bhoi me: Deesa Mohoghol Sagarbhai Popatji Parmar Norendrashh		Branch Name: Kosamba	170662017888 170662022386 170662022458 170662021145 Branch Nam 139762007621 Branch Name: 042962005875 Branch Name: Alke 436562000300 Branch Name: 008562006336
Branch Name: Branch Name: 657362000556 Branch Name: 046662012260 046662013840 046662013973 Branch Name: 049762020587	me: Dabhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Tineshbhai Me: Dadheda Akshaybhai Vasava Baharukh Hahai Mohammadarsh Salimbhai Mevati Alay Asy Asy Asy Asy Asy Chimanbhai Bhoat Chimanbhai Bhoat Chimanbhai Bhoat Sagaphai Popatii Parmar Narendrasinh Ranajisinh Ranajisinh Sada		Branch Name: Kosamba 138462003708 Muskan Shahikh	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Name 139762007621 Branch Name: Alk: 436562000300 Branch Name: V 008562006336
Branch Name: Branch Name: 657362000556 Branch Name: 046662012260 046662013840 046662013973 Branch Name: 049762020587	me: Dabhai Bariya Tineshbhai Bariya Bariya Bariya Bariya Bariya Bariya Bariya Bariya Bariya Alai Bariya Bar		Branch Name: Kosamba	170662017888 170662022386 170662022458 170662021145 Branch Nam 139762007621 Branch Name: 042962005875 Branch Name: Alke 436562000300 Branch Name: 008562006336
Branch Name: 57362000556 Branch Name: 146662013260 146662013840 146662013973 183962002585 Branch Name: 149762019493 149762020587	me: Dabhai Bariya Tineshbhai Bariya B		Branch Name: Kosamba 1384620012818 Muskan Shahil	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nam 139762007621 Branch Name: Glick 436562000300 Branch Name: V 008562006336
Branch Name: 049662013840 046662013840 046662013973 046662013973 049762019493 049762020587 049762020589 049762020589 049762020589	me: Dabhoi Bariya Tineshbhai Tineshbhai Tineshbhai me: Dadheda Akshaybhai Vasava Dahad-Sujarat Shahrukh Munda Mohammadarsh Salimbhai Mevati Vijaybhai Tineshbai Bhoi me: Deesa Mohoghol Sagarahai Popatji Parmar Narendrashhi Parmar Narendrashhi Solanki Deesa - Bagicha		Branch Name: Kosamba 138462002378 Muskan Shokhari Fanch Name: Lunawada Muskan Shokhari Fanch Name: Mota Borsara Fanch Name: Mota Borsara Fanch Name: Mota Borsara Fanch Name: Nellambal Fanch Name: Palitama Fanch Name: P	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nom 139762007621 Branch Name: Alke 436562000300 Branch Name: V 008562006336 Branch Name: V 0085620063300 Branch Name: Nam
Branch Name: Branch Name: Branch Name: Branch Name: Branch Name: M46662013840 M46662013840 M4666201385 Branch Name: R7 M3806200052	me: Dabhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya		Branch Name: Kosamba 138462001379 Muskan Sharak Muskan	170662017888 170662022386 170662022458 170662021145 Branch Nam 139762007621 Branch Name: Branch Name: 436562000340 Branch Name: 008562007300 Branch Name: 017962007300 Branch Name: 017962007300
Branch Name: 049662013840 046662013840 046662013973 046662013973 049762019493 049762020587 049762020589 049762020589 049762020589	me: Dabhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Tineshbhai Me: Dadheda Akshaybhai Vasava Dahad-Gujarat Shahrukh Humda Mohammadarsh Salimbhai Mevati Vijaybhai Chimanbhai Bhoat Chimanbhai Bhoat Sagarbhai Popatil Parmar Narendrasinh Ranajisinh Ranajisinh Solamk Liteshkumar Trilokchandra Hiteshkumar Trilokchandra		Branch Name: Kosamba 138462003798 Muskan Shorker	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nome: 436562000300 Branch Name: V 00562006336 Branch Nome: V 017962007300 Branch Nome: V 017962007300 Branch Nome: V
Branch Name: Branch Name: Branch Name: Branch Name: Branch Name: M46662013840 M46662013840 M4666201385 Branch Name: R7 M3806200052	me: Dabhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Tineshbhai Pethada Aksheybhai Vasava Dahad-Gujarat Shahrukh Hamidbhai Munda Mohal Mevati Alay Ravindrakumar Sheth Ushai Gujarat Alay Ravindrakumar Sheth Gujarat Mahandrakumar Ghoghol Sagarbhai Popatji Parmar Narendrasinh Rasjitshi Dessa Bagicha Julian J		Branch Name: Kosamba 138462003708 Muskan Shokhar Branch Name: Lunawada Muskan Shokhar Branch Name: Muskan Shokhar Branch Name: Mota Borsara T59062009149 Prakashpuri Bava Branch Name: Mota Borsara T59062001587 Chetanprakash Virgular Chetanprakash	170662017888 170662022386 170662022458 170662021145 Branch Nam 139762007621 Branch Name: Branch Name: 436562000340 Branch Name: 008562007300 Branch Name: 017962007300 Branch Name: 017962007300
Branch Name: 638062013840 646662013260 646662013973 646662013973 649662013973 649762020587 649762020589 67anch Name: 88 638062000052 67anch Name: 87 638062000052	me: Dabhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Bari		Branch Name: Kosamba 138462003798 Muskan Short	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nome: 436562000300 Branch Name: V 00562006336 Branch Nome: V 017962007300 Branch Nome: V 017962007300 Branch Nome: V
Branch Name: Branch Name: Branch Name: Branch Name: Branch Name: Ma6662013840 046662013840 046662013973 049762020587 049762020587 049762020589 Branch Name: Ric Magagagagagagagagagagagagagagagagagagag	me: Dabhoi Bariya Tineshbhoi Bariya Tineshbhoi Bariya Tineshbhoi Bariya Tineshbhoi Bariya Tineshbhoi Bariya		Branch Name: Kosamba	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nom 139762007621 Branch Name: Alick 436562000300 Branch Name: V 00856200636 Branch Name: V 008562007300 Branch Name: V 017962007300 Branch Name: V 017962007300
Branch Name: 634062013840 Branch Name: 64662013260 646662013840 646662013973 646662013973 649762020587 649762020589	me: Dabhai Bariya Tineshbhai Bariya Tineshbhai Bariya Bari		Branch Name: Kosamba 138462003798 Muskan Short	170662017888 170662022386 170662022458 170662021145 Branch No. 399662002406 Branch Nam 139762007621 Branch Name: Alki 436562000300 Branch Name: 008562006336 Branch Name: 017962007300 Branch Name 085662002142 205662002142

136562000300

Vijaybha Kalabhai

Date: 27.05.2025 Place: Ahmedabad, Valsad, Morbi, Vadodara, Surat, Aravalli, Botad, Dohad, Bhavnagar, Gandhinagar, Jamnagar, Mahesana, Rajkot, Surendranagar, Gir Somnath, Anand, Banas Kantha, Bharuch, Chhotaudepur, Devbhumi Dwarka, Kheda, Narmada, Patan, Kachchh, Mahisagar, Navsari, Sabar Kantha

10.5 55.3 19.44 -3.71 26.32 52.430 505.470 824.060 368.470 1.626.740 Total comprehensive income for the period/year 372.400 504.340 52.430 1,627.260 825,140 Paid-up equity share capital (face value of Rs.10 per share) 2,005.200 2,005.200 2,005.200 2,005.200 2,005.200 Other equity (excluding revaluation reserve) 4,269.520 5,846.650 4,269.520 EPS in Rs. (Face Value of Rs.10/- each)* 1.860 2.520 0.260 8.120 4.110 8.120 1.860 2.520 0.260 4.110 Key numbers of Standalone Financial Results: Quarter ended Year ended Year ended 31-03-2024 31-03-2025 31-03-2024 31-03-2025 31-12-2024 (Audited) (Audited) (Audited) (Unaudited)

Quarter ended

(Unaudited)

501.760

501.760

31-03-2025 31-12-2024

3,350.410 2,358.270

(Audited)

387.910

387.910

PARTICULARS Total income from operations 3,350.410 | 2,358.270 | 1,597.710 10,402.040 7.315.480 387.910 501.760 62.930 1,653.060 879.350 Profit/(Loss) before tax Net Profit/(Loss) for the period/year 368.470 505.470 52.430 1,626.740 824.060

The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Year ended March, 2025. filed with the Stock Exchanges under Regulation 33 of he SEBI (Listing and Other Disclosuré Reguirements) Ragutations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange website: www.bseindia.com, www.nseindia.com and on the Company's website www.indousagriseeds.com.

For INDO US BIO-TECH LIMITED

Date : 26-05-2025

રાજભવનના કર્મચારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર - 'ઐશ્વર્યમ'નું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ

રાજભવનના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ગાંધીનગરમાં નવનિર્મિત આવાસીય પરિસર -'એશ્વર્ય+' નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે લોકાર્પણ કર્યું હતું. રાજભવન પરિવારને અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ આવાસો અર્પણ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, 'ઐશ્વર્યમ' એટલે સુખ-સમૃદ્ધિ અને ધન-

અભ્યર્થના. ગાંધીનગરના જ-માર્ગ પર વર્ષોથી રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ હતા. શ્રી આચાર્ય દેવવ્રતજીએ

વિસ્તારોમાં ચાલી રહેલા ભારે

વરસાદને લઈને જાહેર કરાયેલી

એડવાઈઝરીમાં એયર ઈન્ડિયાએ

જણાવ્યું- "મુંબઈમાં વરસાદ અને વાવાઝોડાને કારણે વિમાન સંચાલન

પ્રભાવિત થઈ રહ્યું છે. મુસાફરીને સરળ બનાવવા માટે, અમે અમારા

મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા

તેંમની ફ્લાઈટની સ્થિતિ તપાસવાની

ચાલુ છે. સવારે ૯ થી ૧૦ વાગ્યાની

વર્ચ્ચે ફક્ત એક કલાકમાં સૌથી વધુ

વરસાદ નરીમન પોઈન્ટ ફાયર

સ્ટેશનમાં નોંધાયો, જ્યાં ૧૦૪ મિમી

વરસાદ રેકોર્ડ થયો. આ ઉપરાંત, એ

વોર્ડ ઓફિસમાં ૮૬ મિમી, કોલાબા

પંપિંગ સ્ટેશનમાં ૮૩ મિમી અને

મ્યનિસિપલ હેડ ઓફિસમાં ૮૦

મિમી વરસાદ નોંધાયો. કોલાબા

ફાયર સ્ટેશનમાં ૭૭ મિમી, ગ્રાન્ટ

રોડ આઈ હોસ્પિટલમાં ૬૭ મિમી,

મેમનવાડા ફાયર સ્ટેશનમાં ૬૫

આગથી અસરગ્રસ્ત વેસ્ટ કાગળ અને

બગડેલા લાકડાનું પાવડર

રસ ધરાવતા ખરીદદારોને આગથી અસરગ્રસ્ત

વેસ્ટ કાગળ અને બગડેલા લાકડાનું પાવડના

નિકાલ માટે ઇ-હરાજીમાં ભાગ લેવા માટે લમ્પ

સમ્પના આધારે આમંત્રિત કરવામાં આવે છે

વિષય બચાવનું વેચાણ ''જેમ છે ત્યાં છે'', ગમે

ત્યાં છે'' અને "કોઈ ફરિયાદ નથી''ના આધારે

કરવામાં આવશે અને તે **મેસર્સ લેમીટ પેપર્સ**

એલએલપી.ની છે. વિષય સામગ્રીનું નિરીક્ષણ

કસવા ટાઈલ્સપ્રા.લિ.- સર્વે નં.૧૨૭૩, ખાખરીચી, માલીયા, અમદાવાદ હાઈવે, મોરબી, ગુજરાત-

૩૬૩૬૩૦ ખાતે **તા. ૨७-૦૫-૨૫થી ૦૪-૦૬-૨૫**ની

વચ્ચે સવારે **૧૦થી સાંજે ૫ વાગ્યા સુઘી** માત્ર કામકાજના દિવસોમાં **શ્રી પાર્થ કૈલા**

esacqe४ooo અને શ્રી. નિકુંજ દેગોજા esacq४४ooo પર સંપર્ક કરીને નિરીક્ષણ કરી

ઇ-હરાજી ૦૫.૦૬.૨૫ના રોજ ચોજાશે

ઈ હરાજીના નિયમો અને શરતો સાથેનં

https:// www.sealthedeal.co.in/

પરથી ડાઉનલોડ કરો અથવા શ્રી નિતીન કુમાર મો.હ૦૧૧૮૩૦૯૭૫ પર સંપર્ક કરો.

હરાજી કરનાર સીલ ધ ડીલ જેની રજીસ્ટર

પ રોહિણી, દિલ્હી-૧૧૦૦૮૫

ફોર્મ અને ઈએમડી ડીમાન્ડ ડ્રાફ્ટ સાથે બ્રમિશન કરવાની છેલ્લી તા.૦૪-૦૬-૨૫ છે.

મુંબઈમાં ભારે વરસાદનો કહેર

સલાહ આપીએ છીએ.'

સંપદા. આ આવાસીય પરિસર

રાજભવનના પરિવારજનોને

આશ્રયની સાથોસાથ સુખ, સન્માન,

શાંતિ અને સંતોષ પણ આપે એ જ

૯૩७ દિવસમાં 'ઐશ્વર્થમ' પરિસરમાં ચ-કક્ષાના ૯૬, ઘ-કક્ષાના ૩૨, ગ-૧ કક્ષાના ચાર અને ક-કક્ષાના ચાર આવાસો ઉપરાંત કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, ૧૦ દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપ્રશ્ન

ગુજરાતના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો ત્યારે તેમણે અત્યંત જર્જરીત થઈ ગયેલા સ્ટાફ ક્વાર્ટર્સના નવનિર્માણનું કામ હાથમાં લીધું હતું. તા. ૧ નવેમ્બર ૨૦૨૨ ના રોજ તેમણે આવાસીય પરિસરના નવનિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. આજે ૯૩૭ દિવસમાં આ પરિસરમાં ચ-કક્ષાના ૯૬, ઘ-કક્ષાના ૩૨, ગ-૧ કક્ષાના ચાર અને ક-કક્ષાના ચાર ભવ્ય આવાસોનું નિર્માણ કરાયું છે. આ

કોમ્યુનિટી હૉલ- 'સરસ્વતી सदनमं, संपूर्ण सुविधायुक्त राष्ट्रभवन आरोग्य हेन्द्र, १० દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપગ્ન થયું છે. આ આવાસીય પરિસરને 'ઐશ્વર્ય+' નામ આપવામાં આવ્યું છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તક્તિનું અનાવરણ કરીને 'ઐશ્વર્યમ' નું લોકાર્પણ કર્યું હતું. રાજ્યપાલ શ્રી એ આજે આ પરિસરમાં સ્ટેટ બેંક ઑફ ઉપરાંત આ પરિસરમાં ભવ્ય ઈન્ડિયાના એ.ટી.એમ. સેન્ટરનું

ઉદ્ઘાટન પણ કર્યું હતું. 'સરસ્વતી સદનમ' માં આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, 'ઐશ્વર્યમ' માં હંમેશા ભાઈચારો, એકતા અને પરસ્પર સહિષ્ણુતાનું વાતાવરણ જળવાઈ રહે. રોજભવનની કોલોનીમાં ક્ચારેય કોઈ દૂર્વ્યસન કે અનુચિત આચરણ ન થાય એ જોવાની જવાબદારી હવે અહીં વસતા પરિવારોની છે. બાળકો સૌથી મોટી પૂંજી છે. 'ઐશ્વર્ય+' માં રહેતા-ઉછરતા બાળકોને એવું જીવન મળે કે તેઓ મોટા થઈને ઈતિહાસ રચે એવા પદ પર પહોંચે.

'એશ્વર્ય+' આદર્શ કોલોની બને એવી અભિલાષા વ્યક્ત કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, કોઈને પણ આદર્શ કોલોની જોવી હોય તો તે રાજભવનની 'ઐશ્વર્ય+' કોલોની જોવા આવવો જોઈએ. આ સુંદર પરિસર અહીં વસતા પરિવારોના જીવનની સમૃદ્ધિનો આધાર બને એમ તેમણે કહ્યું હતું. 'એશ્વર્યમ' માં વસતા પરિવારો પ્રગતિ કરે, ઉન્નતિ કરે અને ઐશ્વર્યશાળી બને એવી શુભકામનાઓ સાથે તેમણે પરિસરનું લોકાર્પણ કર્યું હતું.

પરિસરના ઉદ્યાનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું તથા આવાસીય પરિસરનું અવલોકન કર્યું હતું. રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ

શ્રી અશોક શર્માએ રાજભવન પરિવારવતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, રાજ્યપાલશ્રીના સતત માર્ગદર્શનથી આ ભવ્ય અને સુંદર પરિસરનું નિર્માણ થયું છે, ત્યારે આપણા સૌની જવાબદારી છે કે, તેને ભૌતિક અને નૈતિક રીતે સ્વચ્છ રાખીએ. અહીં રહેતા કર્મયોગી કોઈ પ્રકારનું વ્યસન ના કરે અને આ પરિસરને એક આદર્શ પરિસર બનાવવામાં સહયોગી બને તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર તથા અધિક સચિવ શ્રી પતંજિલ મિશ્રાએ સ્વાગત પ્રવચન કરીને પરિસર અંગે માહિતી આપી

આ અવસરે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના ગાંધીનગર સર્કલના જનરલ મેનેજર શ્રી ચંદ્રશેખર વી., રાજ્યપાલશ્રીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્રસિંહ વિદ્યાલંકારજી, રાજ્યપાલશ્રીના ગૃહ નિયામક શ્રી એ.કે.જોષી, સ્ટેટ ર્બેન્ક ઑફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ, રાજભવનના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા

શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની ભવ્યતાથી ઉજવણી કરાશે



(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ ઉપર આવેલ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે તા. ૨૭.૦૫. ૨૦૨૫ને મંગળવારના રોજ શ્રી શનિદેવ જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. મંદિરના મહંતશ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું છે કે શ્રી શનિદેવ જન્મોત્સવ પ્રસંગે સવારે ૧૦.૦૦ થી બપોરે ૦૧.૦૦ વાગ્યે મંદિર ખાતે આવેલ શનિદેવની શિલાનું તેલથી લઘુરુદ્રભિશેક કરવામાં આવશે. સાંજે ૬.૦૦ થી ૮.૦૦ કલાકે સમગ્ર વિશ્વમાં શાંતિ અને કલ્યાણ અર્થે શનિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે સાંજે ૭.૦૦ થી ૯.૦૦ કલાકે બટુક ભોજન અને રાત્રે ૮.૩૦ કલાકે શ્રી શનિદેવ જન્મોત્સવની મંગલ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ દિવસે શનિભકતો શ્રી શનિદેવને સરસોનું તેલ, કાળું કાપડ, કાળા અડદ,કાળી છત્રી, કાળા બુટ-ચંપલ, લોખંડની વસ્તુઓને અર્પણ કરી વિશેષ પુષ્યનો લાભ પ્રાપ્ત કરી શકે છે.

ફોર્મ નંબર યુઆરસી-૨

ચેપ્ટર XXI ના ભાગ I હેઠળ નોંધણી અંગે જાહેરનામું કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૩૭૪(બ) અને કંપનીઓ (અધિકૃત નોંધણી) નિયમો,

૨૦૧૪ના નિયમ ૪(૧) મુજબ આથી જાહેર કરવામાં આવે છે કે કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૩૬૬ની ઉપકલમ

- (૨) મુજબ, આ જાહેરનામું પ્રકાશિત થયાના પંદર દિવસો બાદ પરંતુ ત્રીસ દિવસોની અવર્ષિ પૂર્ણ થવા પહેલા ગુજરાત, દાદરા અને નગર હવેલીના રજિસ્ટ્રાર પાસે DIGIMORE LLP, એક લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) એ કંપની તરીકે ભાગ I, ચેપ્ટર XXI હેઠળ, શેર દ્વારા મર્યાદિત કંપની તરીકે નોંધણી માર્ટ અરજી કરી છે.
- પ્રસ્તાવિત કંપનીના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છેઃ
- અન્ય વિદ્યુત ઉપકરણોનું ઉત્પાદન અને વેપાર, જેમાં માઇક્રોફોન્સ (કોન્ડેન્સર, ડાયનેમિક, રિબન, અને યુએસબી માઇક્રોફોન્સ), વાયરલેસ સિસ્ટમ્સ, બૂમ આર્મ્સ અને ઍક્સેસરીઝનો સમાવેશ થાય છે.
- પ્રસ્તાવિત કંપનીના મેમોરેન્ડ્રમ અને આરટિકલ્સ ઓફ એસોસિએશનનો ડ્રાફ્ટ નકલ નીચે જણાવેલ સરનામે કંપનીના કાર્યાલયમાં તપાસી શકાય છેઃ
- બી-૧૦૨, પ્રથમ માળ, અભિષેક કોમ્પ્લેક્સ, અસારવા, અમદાવાદ, ગુજરાત, ભારત 🗕
- આથી જાહેર કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ અરજી સામે આપત્તિ ધરાવે તો તે વ્યક્તિએ તેના લેખિતમાં આપત્તિનું નિવેદન સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર (CRC), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ કોર્પોરેટ અફર્સ (IICA), પ્લોટ નં. ૬, ૭, ૮, સેક્ટર-પ, IMT માનેસર, જિલ્લો ગુરુગ્રામ (હરિયાણા), પિન કોર્ડ – ૧૨૨૦૫૦ ખાર્ત મોકલવાનું રહેશે, જે આ જાહેરનામું પ્રકાશિત થયાના ૨૧ (એકવીસ) સ્પષ્ટ દિવસોની અંદર થવું જોઈએ. આપત્તિની

તારીખઃ ૨૭ મે ૨૦૨૫

નકલ કંપનીના નોંધાયેલ કાર્યાલય પર પણ મોકલવી રહેશે. DIGIMORE LLP તરફથી

રાજેશ નેનવાણી નિર્દેશિત ભાગીદાર (DPIN: 07650137)

અને હવાઈ સેવા ખોરવાઈ (એજન્સી) મુંબઇ, મિમી, માલાબાર હિલમાં ૬૩ મિમી કુર્શે ચોક, બિંદુમાધવ જંક્શન (વલી) અને માચરજી જોશી માર્ગ (ફાઈવ અને ડી વોર્ડમાં ૬૧ મિમી વરસાદ મુંબઈમાં ભારે વરસાદ અને તીવ્ર પવનને પગલે સામાન્ય જનજીવન માપવામાં આવ્યો.

મુંબઈમાં ભારે વરસાદથી ટ્રેન

પૂર્વીય ઉપનગરોની વાત કરીએ ખોરાવાયું છે, એવા સમયે રેલવે, તો, ત્યાં તુલનાત્મક રીતે ઓછો માર્ગની સાથે હવાઈ મુસાફરી Air વરસાદ થયો છે. માનખુર્દ ફાયર India issues advisory ઉપર પણ અસર પડી છે. મુંબઈના સ્ટેશન અને એમપીએંસ સ્કૂલ ઉપનગરીય વિસ્તારોમાં અવરનવર સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ મુંબઈમાં મૂસળધાર વરસાદની ચેતવણી જાહેર કરી છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દેશ્યતા ઘણી ઓછી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ વરસાદની અસર ટ્રાફિક પર પણ પડી છે. વિમાન ઓફિસ અને વિલે પાર્લે ફાયર સ્ટેશનમાં ૨૨ મિમી વરસાદ થયો. પાણી સંચાલન પ્રભાવિત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વિમાનન કંપની એયર ભરાવાના મુખ્ય સ્થળોમાં શક્કર ઈન્ડિયાએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી મુંબઈ અને તેની આસપાસના પંચાયત, સાયન સર્કલ, દાદર ટીટી,

હિંદમાતા, જેજે મડાવી પોસ્ટ ઓફિસ,

માનખુર્દમાં માત્ર ૧૬ મિમી, નૂતેન વિદ્યાલય મંડળમાં ૧૪ મિમી અને કલેક્ટર કોલોનીમાં ૧૩ મિમી વરસાદ નોંધાયો. પશ્ચિમી ઉપનગરોમાં બાંદ્રા સુપારી ટેક્ર, ગજદરબંધ પંપિંગ સ્ટેશન અને ખાર દાંડામાં ૨૯ મિમી, જ્યારે સ્વચ્છતા વિભાગ વર્કશોપ, એચઈ વોર્ડ

ગાર્ડન) નો સમાવેશ થાય છે. તેજ પવનો અને વરસાદને કારણે ઝાડ અને ડાળીઓ ખરી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. શહેરમાં ૪ સ્થળોએ અને પશ્ચિમી ઉપનગરોમાં પ સ્થળોએ ઝાડ ખરી પડવાની માહિતી બીએમસીને મળી છે. હવામાન વિભાગે આજે માટે IMD એ રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ, ઠાણે, પાલઘર અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ૩-૪ કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો સાથે ગાજવીજ અને ભારે વરસાદની

અમૂલ ડેરી દૂધની ખરીદીના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૧૦નો વધારો કરશે

(પ્રતિનિધિ)આણંદ, શ્રી વિપુલભાઈ પટેલ, ચેરમેન, અમૂલ ડેરી, આણંદ દ્વારા અમૂલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત દૂધના ભાવમાં વધારો અને અમૂલ દાંશના ભાવમાં ઘટાડો કરવામાં આવેલ છે. આપને જણાવતા આનંદ થાય છે કે, અમૂલ ડેરી દ્વારા તારીખ ૦૧.૦૬.૨૦૨૫ સવારથી દૂધ ઉત્પાદકોને ચક્વવામાં આવતા દર્ધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૧૦ નો વધારો કરવામાં આવશે. આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા ૮૫૫ થી વધારી ૮૬૫ આપવામાં આવશે. ઉપરોક્ત નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકડાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ૭લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. આ સાર્થે અમૂલ ડેરી ગુજરાતની તમામ

આપતી સંસ્થા બની છે, જે અમારાં

તમામ દૂધ ઉત્પાદકો માટે ગૌરવની વાત છે. ભેંસના દૂધનો ભાવ હવે રૂ. પા. ૪૪ પ્રતિ લિટર (६% ફેટ) જે પહેલા રૂ.પર.૮૨ હતો ગાયના દૂધનો ભાવ રૂ. ૩૬.૨૫ પ્રતિ લિટર રહેશે (૩.૫% ફેટ)જે પહેલા રૂ.૩૫.૮૩ હતો

અમૂલ દાણના ભાવમાં ઘટાડોઃ દૂધ ઉત્પાદકોને સહારો આપવા અમુલ સંઘ દ્વારા અમૂલ દાણના ભાવમાં પંo પૈસા પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે. જેથી અમૂલ દાણની ૭૦ કિલોની બેગ દીઠ રૂ.૩૫નો અને ૫૦ કિલોની બેગ દીઠ રૂં. ર પનો ઘટાડો કરેલ છે. આ ઉપરાંત આપ્રલ માહનામા પણ વરદાન દાણમા બેગ દીઠ રૂ.૫૦, ન્યુટ્રી ગાર્ડ દાણમાં બેગ દીઠ રૂં.૬૦, બફેલો દાણમાં બેગ દીઠ રૂ.૧૦૦, ન્યુટ્રી પાવર દાણમાં ડેરીઓમાં સર્વો ચ્ચ દૂધના ભાવ બેગદીઠ રૂ.૨૦૦નો પહેલાથી ઘટાડો કરવામાં આવેલ છે.

નોટીસ

આથી સૂચના આપવામાં આવે છે કે વસંત બેન પટેલના નામે ગુજરાત ગેસ લિમિટેડના ૫૮૨૪૬ ઇક્વિટી શેર નંબર ૫૦૦૦ માટેના પ્રમાણપત્ર (ઓ) ખોવાઈ ગયા છે અથવા ખોટા પડી ગયા છે અને નીચે સહી કરનારે કંપનીને ઉપરોક્ત શેર માટે ડુપ્લિકેટ પ્રમાણપત્ર (ઓ) જારી કરવા માટે અરજી કરી છે. ઉપરોક્ત શેર અંગે કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ દાવો હોય તો તેમણે આ તારીખથી એક મહિનાની અંદર અમારા રજિસ્ટાર, કેફિન ટેકનોલોજીસ લિમિટેડ, સેલેનિયમ ટાવર બી, પ્લોટ ૩૧-૩૨, ગચીબોવલી, ફાઇનાન્સિયલ ડિસ્ટ્રિક્ટ, હૈદરાબાદ-૫૦૦ ૦૩૨ ને પત્ર લખવો જોઈએ, અન્યથા કંપની ડુપ્લિકેટ પ્રમાણપત્ર (ઓ) જારી કરવાની કાર્યવાહી કરશે.

તારીખઃ ૨७/૦૫/૨૦૨૫

શેરધારક(ઓ)ના નામ(ઓ) વસંતા બેન પટેલ

INDO US BIO-TECH LIMITED

(CIN: L01122GJ2004PLC043550)

Regd. Office: 309, Shanti Mall, Satadhar Cross Road, Sola Road, Ahmedabad-380 061, (Gujarat) India Website: www.indousagriseeds.com E-Mail ID: indouscs@gmail.com

Extract of Statement of Audited Financial Results for the Quarter and Year ended 31st March, 2025

(Amounts in Lakhs)							
		Quarter ended	Year ended	Year ended			
PARTICULARS	31-03-2025 (Audited)	31-12-2024 (Unaudited)	31-03-2024 (Audited)	31-03-2025 (Audited)	31-03-2024 (Audited)		
Total income from operations	3,350.410	2,358.270	1,597.710	10,402.040	7,315.480		
Profit/(Loss) before exceptional items and tax	387.910	501.760	62.930	1,653.060	879.350		
Exceptional items- Prior Period Items							
Profit/(Loss) before tax	387.910	501.760	62.930	1,653.060	879.350		
Total tax expenses	19.44	-3.71	10.5	26.32	55.3		
Net Profit/(Loss) for the period/year	368.470	505.470	52.430	1,626.740	824.060		
Total comprehensive income for the period/year	372.400	504.340	52.430	1,627.260	825.140		
Paid-up equity share capital (face value of Rs.10 per share)	2,005.200	2,005.200	2,005.200	2,005.200	2,005.200		
Other equity (excluding revaluation reserve)			4,269.520	5,846.650	4,269.520		
EPS in Rs. (Face Value of Rs.10/- each)*							
-Basic	1.860	2.520	0.260	8.120	4.110		
-Diluted	1.860	2.520	0.260	8.120	4.110		

Voy numbers of Standalana Financial Decultor

Date : 26-05-2025

Rey numbers of Standalone Financial Results:						
	Quarter ended			Year ended	Year ended	
PARTICULARS	31-03-2025 (Audited)	31-12-2024 (Unaudited)	31-03-2024 (Audited)	31-03-2025 (Audited)	31-03-2024 (Audited)	
Total income from operations	3,350.410	2,358.270	1,597.710	10,402.040	7,315.480	
Profit/(Loss) before tax	387.910	501.760	62.930	1,653.060	879.350	
Net Profit/(Loss) for the period/year	368.470	505.470	52.430	1,626.740	824.060	

Notes: The above is an extract of the detailed format of Financial Results for the Quarter and Year ended March, 2025. filed with the Stock Exchanges under Regulation 33 of he SEBI (Listing and Other Disclosuré Reguirements) Ragutations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchanges website: www.bseindia.com, www.nseindia.com and on the Company's website www.indousagriseeds.com.

For INDO US BIO-TECH LIMITED

SD/-Mr. Jagdish Ajudia (Managing Director)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તેNFSUના ૧૧મા 'નાગપુર કેમ્પસ'નું ભૂમિપૂજન-શિલાન્યાસ સંપશ્ન

NFSU*ભાર* તમાં इोरेन्सिङ निष्शातोनी વધતી માંગને પહોંચી વળવા રાષ્ટ્રભરમાં કેમ્પસનું વિસ્તરણ કરી રહ્યું છેઃ અમિત શાહ

ગાંધીનગર,

શ્રી અમિત શાહ, માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી, ભારત સરકાર દ્વારા નાગપુરના ચિચોલી ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના 'નાગપુર કેમ્પસ'નું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો અને NFSUના ટ્રાન્ઝિટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ તા.૨૬ મે, ૨૦૨૫ના રોજ કર્યું

ું શ્રી અમિત શાહ, માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી, ભારત સરકાર; શ્રી દેવેન્દ્ર ફડણવીસ, માનનીય મુખ્યમંત્રી-મહારાષ્ટ્ર; શ્રી નીતિન ગડકરી, માનનીયે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી. ભારત સરકાર: શ્રી ચંદ્રશેખર બાવનકુલે, માનનીય મહેસૂલ મંત્રી, મહારાષ્ટ્ર સરકાર સહિત અનેક મહાનુભાવો હાજર

આ સમારોહમાં શ્રીમતી સુજાતા સૌનિક, મુખ્ય સચિવ, મહારાષ્ટ્ર સરકાર; 'પદ્મશ્રી'થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU સહિત વિવિધ ર્ક્ષેત્રોના અનેક મહાનુભાવો હાજર

શ્રી અમિત શાહ, માનનીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી, ભારત સરકારે સોમવારે નાગપુરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા NFSUને ફાળવવામાં આવેલી લગભગ ૫૦ એકરની કાયમી કેમ્પસ માટેની જમીન પર 'ભૂમિપૂજન' તથા શિલાન્યાસ કર્યું હતું. આ પ્રસંગે,

નામ બદલેલ છે

મેં મારું નામ આચુ ઊર્ફે આચુષી

સુનીલ થવાણી હતું, જે બદલીને

આયુષી સુનીલ થવાણી કરેલ છે. સરનામું : એ-૩૧ ઈસીતા કો-

ઓપ હાઉસિંગ સો, નવરંગપુરા,

અમદાવાદ

માનનીય કેન્દ્રીય મંત્રીએ NFSUના ટ્રાન્ઝિટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કર્યું હતું.

ઁશ્રી અમિત શાહ, માનની**ય**

ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી, ભારત સરકારે જણાવ્યું હતું કે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર ફોરેન્સિક નિષ્શાતોની તીવ્ર માંગને પહોંચી વળવા અને ભારતની જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને મજબૂત બનાવવા માટે દેશભરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી કેમ્પસનો વિસ્તાર કરી રહી છે. 'નાગપુર કેમ્પસ' એ NFSUનું ૧૧મું કેમ્પસ બન્યું છે. NFSUના ગુજરાત, નવી દિલ્હી, ગોવા, ત્રિપુરા, મધ્યપ્રદેશ, કર્શાટક, આસામ, મણિપુર, પુણે અને વિદેશમાં યુગાન્ડામાં કેમ્પસ છે. NFSUનું નાગપુર કેમ્પસ પશ્ચિમ ભારતના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની અનેક તકોના દ્વાર ખોલશે. NFSU રાષ્ટ્રીય સ્તરે કાયદો અને વ્યવસ્થાને મજબૂત

યોગદાન આપી રહ્યું છે. NFSUના સ્થાપક કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે NFSUનું 'નાગપુર કેમ્પસ' મહારાષ્ટ્રના ફોરેન્સિક તપાસ માળખાને મજબૂત બનાવવા માટે

લેસ્ટર્ને ટાઇસ્સ

વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત

જાહેરાતો અંગે વાંચકોએ

પોતાની રીતે ચકાસણી કરી

નિર્ણય લેવો.

અને પરિણામલક્ષી બનાવવામાં

એક મહત્વપૂર્ણ પગલું છે. મહારાષ્ટ્ર સરકાર દારો ફાળવવામાં આવેલી ૫૦ એકર જમીન સાથે, કાયમી કેમ્પસને ફોરેન્સિક અને સંલગ્ન વિજ્ઞાન માટે શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. NFSUના ટ્રાન્ઝિટ કેમ્પસમાં આ શૈક્ષણિક વર્ષ, ૨૦૨૫-૨૬થી ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ સાથે પાંચ વિશિષ્ટ શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ થશે. જેમાં, એમ.એસસી. ફોરેન્સિક સાયન્સ, એમ.એસસી. સાયબર સિક્ચુરિંટી, બીબીએ-એમબીએ (ફોરેન્સિક એકાઉન્ટિંગ), બી.ટેક-એમ.ટેક્. સાયબર સિક્ચોરિટી અને પ્રોફેશનલ ડિપ્લોમા ઇન ક્રાઇમ સીન મેનેજમેન્ટ-નો સમાવેશ થાય છે.

ઈ હરાજી સૂચના કુંગળી અને લસણના વિવિધ પ્રકારો પર આશરે ૩,હર,૨૦૦ કિલો

રસ ધરાવતા ખરીદદારોને ડુંગળી અને લસણના વિવિધ પ્રકારો પર આશરે ૩,૭૨,૨૦૦ કિલો પાણીનો પ્રભાવનુ પર કિ.ગ્રા.ના આધારે ઇ-ઓક્શનમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. વિષય બચાવનું વેચાણ ''જેમ છે ત્યાં છે'' ગમે ત્યાં છે'' અને ''કોઈ ફરિયાદ નથી''ના આધારે કરવામાં આવશે અને તે **મેસર્સ રીચલ કિહાઈફ્રેટ્સ** એન્ડ મેસર્સ. રીયલ ફૂડ્સ એન્ડ સ્પાર્ઘસીસની છે. વિષય સામગ્રીનું નિરીક્ષણ સર્વે નં.૧૪૩ પીપ અને સર્વે નં.૧૪૩ પી-૫ પી૧, ભાનવડ રોડ, ભાનવડ ગામ, મહુવા, ગુજરાત-૩૬૪૨૯૦ ખાતે તા.૨૬-૦૫-૨૫ થી ૨૯-૦૫-૨૫ વચ્ચ શ્રી પ્રદીપ મોજાની ૮૩૪७०७७૩૫૬ (મેસર્સ. રીચલ ડિહાઈડ્રેટ્સ) અને શ્રી ભરતભાઈ બાંભણીયા ૯૯૦૪૫૯૨૬૮૬ (મેસર્સ. રીચલ કુડ્સ એન્ડ સ્પાઈસીસ) પર સંપર્ક કરીને નિરીક્ષણ કરી શકાશે.

ઈ-હરાજી ૩૦-૦૫-૨૫ના રોજ ચોજાશે

ઈ હરાજીના નિયમો અને શરતો નું ફોર્મ મેળવવા માટે કૃપા કરીને **શ્રી અતુલ હાલારંકર મો. ७७૩૮૧૬૪૦૬૯** પર સંપર્ક કરો અથવા વેબસાઈટ https:// www.sealthedeal.co.in/ પરથી

હરાજી કરનારઃ સીલ ધ ડીલ જેની રજીસ્ટર ઓફીસ દુકાન નં.૧૪૮ પોકેટ સી-૨, સેક્ટર-પ રોહિની,

-જાહેરખબર મેનેજર

SUVIDHA INFRAESTATE CORPORATION LIMITED

[CIN: L70102GJ1992PLC016978] Registered Office: A-305,306 Krishna complex, Opp. Devashish School, Bodakdev, Ahmedabad - 380 054

AUDITED STANDALONE FINANCIAL RESULTS

FOR THE FINANCIAL YEAR ENDED ON 31ST MARCH, 2025

The Board of Directors in their meeting held on 26th May, 2025, have approved and taken on record the Audited Financial Results for the Quarter and year ended on 31st March, 2025 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015.

The aforesaid Audited Financial Results for the year ended 31st March, 2025along with Auditors Report thereon are available on website of BSE Limited at www.bseindia.com and also on Company website and can also be accessed by scanning below Quick Response Code: In case there are any question on the above disclosure, please reach out to us at



: 26^h May, 2025 Place: Ahmedabad

By Order of the Board For Suvidha Infraestate Corporation Limited KISHORE K. GOSWAMI MANAGING DIRECTOR (DIN: 00289644)

વૈશાલીબેન ધવલકુમા

રૂપલ ધર્મેન્દ્ર મસાલાવાલા

ગોહિલ અર્જુનસિંહ સુખદેવસિંહ નરેશ જીવાભાઈ જોલીયા

બીપીનકુમાર ગલબાભાઈ પટેલ

રાજેન્દ્રસિંહ પરમાર

જોધાભાઈ કામાભાઈ રબારી જનકભાઈ જાજરીયા

अहेर नोटिस ficici Bank રજિ. ઓફિસ : આઈસીઆઈલીઆઈ બેંક ટાવર, ચકલી સર્કલ પાસે, જૂનો પાદરા રોડ, વડોદરા-૩૯૦ ૦૦૭ કોર્યા રેટ ઓફિસ : આઈસીઆઈસીઆઈ બેન્ક ટાવર્સ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ ૪૦૦૦૫૧

ગોલ્ડ ઇ-લ્ટાજી કમ આમંત્રણ સૂચના ગોલ્ડ ઇ-લ્ટાજી કમ આમંત્રણ સૂચના નીચે જુણાવેલા ઋણ લેનારાઓને સોનાના દાગીના સામેની સુવિધા માટે તેમની બાકી રકમ ચુકવતા નોટિસ આપવામાં આવી છે. ('સુવિધા') તેઓ આઈસીઆઈ સીઆઈ બેંક લિમિટેડ ('આઈસીઆઈસીઆઈ ') પાસેથી મેળવે છે. અમે ૦૯ જૂન, ૨૦૨૫ના પેજ ગીરવે મુકેલા સોનાના ઘરેણાંની ઇ-ઓક્શન કરવા માટે મજબૂર છીએ કારણ કે તેઓ બાકી ચૂકવણી કરવામાં નિષ્કળ ગયા છે. આઈસીઆઈસીઆઈ બેંક પાસે કોઈપણ પૂર્વ સૂચના વિના ખાતું બેંધ કરવાની/ઇ-ઓક્શનની તારીખ બદલવાની સત્તા છે. ઓનલાઈન હરાજી https://jewel-ગયા છે. આઈસીઆઈસીઆઈ બેંક પાસે કોઈપણ પૂર્વ સૂચના વિના ખાતું બેંધ કરવાની/ઇ-ઓક્શનની તારીખ બદલવાની સત્તા છે. ઓનલાઈન હરાજી https://jewel-ગયા છે. આઈસીઆઈસીઆઈ જેક પાસે કોઈપણ પૂર્વ સૂચના વિના ખાતું બેંધ કરવાની/ઇ-ઓક્શનની તારીખ બદલવાની સત્તા છે. ઓનલાઈન હરાજી https://jewel-

લોન ખાતા નં.	ગ્રાહકનું નામ	લોન ખાતા નં.	ગાહકનું નામ	बोन भाता नं .	ગ્રાહકર્
શાખાનું નામઃ ર	ઝમદાવાદ-ખોખરા	364062009457	પરમાર જયેશકુમાર હસમુખભાઈ	शामानुं नामः र 183562002118	ાજકોટ-લંક્ષ્મીનગર
- 750762000585	પવનસિંઘ મોહનસિંઘ		un sula		હિરેન દેવજી
	રાજપૂત	शामानु 137262002509	નામઃ ઘમેજ કાર્તિકકુમાર પટેલ	શાખાનું ના	ામઃ રાજપીપળા
શાખાનું નામ: અ	મદાવાદ-બાપુનગર		ગાલકટુમાર પટલ ગામઃ દ્યોલક ા	137762005365	ભાર્ગવ ગિરીશ
093062003931	202	182962010490			ામઃ સિંદદાપુર
393002003931	અભીષેક હસમુખભાઈ દેવાની		ઘનશ્યામભાઈ દિપુભાઈ પટેલ	183462007803	પ્રવીણકુમાર
ornard arms as	મદાવાદ-ગાંધીરોડ	307862001164	નામઃ ગૌરકકા મેવાડા વિપુલભાઈ	183462008353	વૈશાલીબેન ધ
	_		અરજનભાઈ		શ્રીમા
136905001017	વંદનાબેન શૈલેષકુમાર હાલાણી		MIN: GOGE	शामानुं । 170562013458	નામઃ શિહીર
PIIVIIdi d	ામઃ આણંદ	171162005820	દિલીપભાઈ દેવકરનભાઈ	170562013458	પઢારીયા લક્ષ્મણભ
	રુશીતાબેન જીગ્નેશકુમાર પ્રજાપતિ		ભોરાનીયા	SINHIG! o	તામઃ સુરત-વેસુ
		171162011064	વિજયકુમાર રાજેશભાઈ પાટડીયા	183962001651	સૌરભ નરે
025662004756	રુશીતાબેન જીગ્નેશકુમાર પ્રજાપતિ	शामानं नामः	કળવદ- એપીએમસી		સાધ
		326562001398	જશીબેન કરમશીભાઈ	શાખાનું નામઃ ર	મુરત-અઠવાલાઈન્સ
	સ્લુશર-ઊભાદ્યુકાનું		ભરવાડ	005262012758	લાખાની અનવરચ
776662000378	પુષ્પાનાથ શેટ્ટી	શાખાનું ન	भः श्रमगगर	શાખાનું નામઃ સુર	ત-મીનીબજાર વરાદ
શાખાનું વ	ામઃ બારડોલી	020562013842	જયસુખ ગોવિંદભાઈ કારંગીયા	183862004839	અવૈયા મહે
045962009169	ભાવીશાબેન ધર્મેશકુમાર પટેલ				દેવરાજ
045962009331			મનગર-ગ્રીન સીટી	શાખાનું ના	મઃ સુરત-રાંદેર
045962009331	ભાવીશાબેન ધર્મેશકુમાર પટેલ	467562000090	મીનાક્ષીબેન જાની iiમઃ જસદણ	138662002072	મીનાબેન ધ
045962009929		170862014400	જગદીશ દેવશીભાઈ		ગાર
	મેહુલ ભરતભાઈ જાદવ		બાવલિયા	शामानुं ना 138562005202	ામઃ સુરત-ઉદ્યના
045962009933	મોહમંદશકીલ અલીખાન પઠાણ		ામઃ ક ાલાવડ	138562005202	રૂપલ ધ મસાલા
શાખાનું ત	ામઃ ભચાઉ	791362000115	ગામરા મૈયાભાઈ	शामार्व	वाभः तणाश्र
353762003420			નામઃ ક્લોલ	375762004459	ગોહિલ અર્જુનસિં
શાખાનું નામઃ ભા	વનગર-લોખંડ બજાર	200662001398	અલ્પેશકુમાર પટેલ	શાખાનું	બામઃ વાલાલા
464762000153	સુદર્શનકુમાર મુંદ્રીકપ્રસાદ		ગામઃ કરજણ	215762008257	નરેશ જીવાભ
	યાદવ	213162009206	રાજુભાઈ ભરવાડ	omarai ana	: તલોદ, ગુજરાત
शामानु । 084662009554	નામઃ બૉરસદ જયેશભાઈ જયંતીભાઈ પટેલ		ામઃ ખંભાળિયા	363462002846	કેસરીસિંહ લા
		170462014519	હરદાસભાઈ મેસુરભાઈ ચાવડા	363462003028	
શાખાનું 137562044655	નામઃ બોટાદ ખાચર પ્રતાપભાઈ	Sinutai	નામઃ ખંભાત		બીપીનકુમાર ગલ
137302044033	બાવર પ્રતાપભાઇ આપાભાઈ	183262014296	રાઠોડ રાજુભાઈ , નામઃ ખેડા	363462008335	વિક્રમસિંહ
शास्त्रां ता	મઃ છોટા ઉદેપુર	शामान् 202062004765	નામઃ ખેડા	363462008620	રાજેન્દ્રસિંહ
280962001405	જીનવાલા મસ્તકા	202062004765	કિશન વિક્રમભાઈ ઠાકોર	शाणानं	नाभः शानगढ
280962001408	જીનવાલા મુસ્તફો નામઃ ચીખલી	शामानं	ગામઃ ખેરાલુ	170662023528	જનકભાઈ એ
281062002837	વિમલકુમાર હરીલાલ પટેલ	400662003614	દલજીભાઈ મનસુંગભાઈ	170662018274	
911bilei e	แห: รดเยี		ચૌધરી ઁ		નવધણભાઈ મે
184062010140	બારીયા તિનેશભાઈ	शामानुं न	ામઃ કોરાંબા	170662017888	જોધાભાઈ કામ
184062010062		138462008708	મુસ્કાન શેખ ામઃ લુણાવાડા	170662022386	જનકભાઈ
	બારીયા તિનેશભાઈ	780262000545	માછર ભારતભાઈ	170662022458	રુદાતલા વિજયભ
શાખાનું : 757362000556	ភាអៈ ខមិន	शामानं नामः भान	સા-મુક્તાનંદ કોમ્પ્લેક્સ		રુદાતલા ાવજવલ
	અક્ષયભાઈ વસાવા	172062009149		170662021145	શારદાબેન ભરત
શાખાનું નામ: 046662012260	દાહોદ-ગુજરાત		પ્રકાશપુરી બાવા		સારદાવન ભરત
046662012260	શાહરુખ હમીદભાઈ મુંડા	शामानुं नाम 759062001557	: મોટા બોરસરા		નામઃ થારા
046662013840		759062001557	ચેતનપ્રકાશ વિમલકુમાર નવલખા	399662002406	જયંતીજી અમૃત
	મોહમંદઅર્શ સલીમભાઈ મેવાતી	शामानं नाभः	નલિયા અબડાસા	शामानुं न	ામઃ ઉમરગામ
046662013973	અલય રવીન્દ્રકુમાર શેઠ	170162007185	મુસ્તાક ઈકબાલ ભટ્ટી	139762007621	રોહિત લુલ
363962002585		170162007186	મુસ્તાક ઈકબાલ ભટ્ટી		કર્નો!
363962002585	વિજયભાઈ ચીમનભાઈ ભોઈ		ામઃ નેસડા નવા	शामानु 042962005875	नाभः छेज
શાખાનું	नाभः डीसा	308362000270	સાગરભાઈ નાગજીભાઈ પનકુટા	042962005875	ઈશ્વરભાઈ માલ
049762019493	મહેન્દ્રકુમાર ઘોઘોલ		સાગરભાઇ ગાગજીભાઇ વરાકુદા	શાખાનું નામઃ વડ	ડોદરા- ન્યુ અલ્કાપુ
049762020587	સાગરભાઈ પોપટજી પરમાર	શાખાનું ન	ામઃ ઓલપાડ	436562000300	પટેલ અશ
049762020589	નરેન્દ્રસિંહ રણજીતસિંહ	758262001379	મનીશભાઈ અશોકભાઈ પટેલ	Sinniai alia:	વલ્લભવિદ્યાનગર
	સોલંકી	શાખાનું ન	મઃ પાલીતાણા	008562006336	વ્રકેશાબેન્
omarai ama	ડીસા-બગીયા રોડ	379562002861	અજીતસિંહ જોરસંગભાઈ ચુડાસમા	in Hall C	नाभः वापी
538062000052				017962007300	અનીલકુમ
538062000052	હિતેશકુમાર ત્રિલોકચંદ્ર સોલંકી	शामानु । 224762000737	નામઃ પાનીચા અર્જુનભાઈ બારીયા	Sinalia a	ામઃ વાર્પી-ચલા
शाजानं	તાલકા	શાખાનું ન	ામઃ પાટણ	085662002142	દિવ્યા
171862013983	જગદીશભાઈ રસીકભાઈ	038062007546	રબારી દિનેશભાઈ	શાખાનું	नाभः वासह
	વાઘરી	038062008066	સોલંકી કિશનભાઈ તેજાભાઈ	200962006763	રણછોડભા
	નામઃ દાંદ્યુકા	शामानं व	ін: йзаіє	શાખાનું	नाभः विषापुर
401662003003	દિગ્વિજયસિંહ બીશુભા પરમાર	137362004359	રમેશભાઈ છોટાભાઈ	372562003776	ઠાકોર મ
401662003003					
શાખાનું નામઃ	દાનસુરા, ગુજરાત		પુરબીયા	શાખાનું ના	મઃ બાલાચાપાલ
શાખાનું નામઃ	જયેન્દ્રકુમાર જાલમસિંહ	શાખાનું નામઃ રાજ	પુરબીયા કોટ- અજી ઇન્ડસ્ટ્રીચલ	शामानुं ना 305262010547	મઃ બાલીચાપાલ પ્રદીપકુમ
	દાનસુરા, ગુજરાત જયેન્દ્રકુમાર જાલમસિંહ છાયન કેતનસિંહ બાલુસિંહ પરમાર	શાખાનું નામઃ રાજ		305262010547	મઃ બાલાચાપાલ પ્રદીપકુમ નામઃ મંડીદીપ સાબલપારા જ

રહ.૦૫.૨૦૨૫ અમદાવાદ, વલસાડ, મોરબી, વડોદરા, સુરત, અરવલ્લી, બોટાદ, દાહોદ, ભાવનગર, ગાંદીઓગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરેબ્દ્રનગર, ગીર સોમ્પ આગંદ બનાઅનાંત્રા ભરસ ખોગાઉરેપ્ય દેવભિદ્ય હાર્ચન ખેરા નર્મદા પ્રાયગ

સહી/- અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ વતી

ામઃ વિજાપુર ઠાકોર મહેન્દ્રજી